



RAN-2408000603020006

S.Y.B.Com. (Sem.-III) Examination November - 2025

Major - Banking Law & Practice I

[Total Marks: 50]

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. નીચેના પ્રશ્નો પૈકી કોઈ પણ પાંચ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.

10

- ટાંચના હુકમના પક્ષકારોના નામ જણાવો.
- સામાન્ય લિયનનો અર્થ સમજાવો.
- BHIM નું પૂરું સ્વરૂપ સમજાવો.
- અવધિનો સિદ્ધાંત એટલે શું?
- NACH એટલે શું?
- બેંકના ગ્રાહકની વ્યાખ્યા આપો.
- સાઈબર ફ્રોડ એટલે શું?

પ્ર.2. બેંકર અને ગ્રાહક વચ્ચેના સંબંધના અંતની વિસ્તૃત ચર્ચા કરો.

14

OR

- પ્ર.2. અ. ચેકના અયોગ્ય નકારના જોખમો વર્ણવો.
બ. બેંકરનો ખાતા સરભર કરવાનો અધિકાર સમજાવો.

7

7

- પ્ર.3. અ. ડિજિટલ બેંકિંગના લાભો જણાવો.
બ. ભારતમાં ડિજિટલ બેંકિંગ સામેના પડકારો જણાવો.

7

7

OR

પ્ર.3. ભારતમાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવામાં બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ (BCs) ની ભૂમિકા સમજાવો.

14

પ્ર.4. અ. ટૂંકનોંધ લખો (કોઈ પણ એક)

6

- ટાંચનો હુકમ
- અનિચ્છનીય ગ્રાહક

પ્ર.4. બ. કેસ સ્ટડી

6

તમારા એક ગ્રાહકને એક્સાઈઝ વિભાગ દ્વારા ગેરકાયદેસર વ્યવહારો કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો છે અને આ વિભાગનો એક અધિકારી આ ગ્રાહકના ખાતોઓની માહિતી માંગે છે. બેંકર તરીકે તમે શું કરશો?

ENGLISH VERSION

- Q.1. Answer any Five of the following questions in brief: 10**
1. Name the parties involved in Garnishee Order.
 2. Explain the meaning of General lien.
 3. What is the full form of BHIM.
 4. What is meant by Duration Theory?
 5. What is meant by NACH.
 6. Define the term 'Customer of a Bank'
 7. What is Cyber Fraud?
- Q.2. Discuss in detail the termination of relationship between banker & customer. 14**
- OR**
- Q.2. a. Describe the risks involved in wrongful dishonour of a cheque. 7**
- b. Describe Banker's right to set off accounts. 7**
- Q.3. a. State the advantages of digital banking. 7**
- b. State the challenges against digital banking in India. 7**
- OR**
- Q.3. Explain the role of Business Correspondents (BCs) in promoting financial inclusion in India. 14**
- Q.4. a. Write Short Note(Any one): 6**
1. Garnishee Order.
 2. Undesirable customer.
- Q.4. b. Case Study: 6**
- One of your customers has been convicted by excise department for illegal transactions and the officer of this department wants information about the accounts of this customer. What would you do as a banker?
-